

ત્વરિત જાહેરાત માટે

મેયર બ્રાઉન, કાઉન્સિલર્સ સાથે જીવંત સંગીત અને ઘણાં અનુભવો કરાવનારો બ્રેમ્પટનનો ડ્રાઈવ-થ્રૂ કેનેડા ડે માણવાનું ચૂકશો નહીં

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 29, 2020) – વેબસાઈટ www.brampton.ca/canadaday પર બ્રેમ્પટનના ઓનલાઈન કેનેડા ડે કાર્યક્રમો ઉપરાંત, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને કાઉન્સિલરો બ્રેમ્પટનની કેનેડા ડે ઉજવણીઓ રોડ પર લઈ જવાના છે! કાઉન્સિલના સભ્યોએ જુલાઈ 1 નાં રોજ જીવંત સંગીત, કૂડ ટ્રક્સ, અને વોર્ડની દરેક જોડીમાં સ્થાનિક બેકરીઓમાંથી મફત કૂકીસનું આયોજન કર્યું છે.

આ રૂબરૂ માણવાલાયક ઉત્સવોનું આયોજન બ્રેમ્પટન રિક્લિએશન સેન્ટરના પાર્કિંગ લોટ્સમાં આઉટડોર કરવામાં આવશે. રહેવાસીઓને COVID-19 નો ફેલાવો ટાળવા પોતાના વાહનો ડ્રાઈવ કરીને વાહનોમાં જ રહેવાનું કહેવામાં આવે છે. પોતાના વાહનોમાંથી, રહેવાસીઓ જીવંત સંગીત અને ડ્રાઈવ-થ્રૂ કૂડ ટ્રક્સની પ્રક્રિયા મારફતે ખાદ્યપદાર્થો ખરીદી શકે છે. મેયર અને વોર્ડ કાઉન્સિલરો મારક્સ અને ગ્લોવ્સ પહેરીને, પુસ્તકો ઉપલબ્ધ રહે ત્યાં સુધી, વાહનોમાં મફત કૂકીસનું વિતરણ કરશે.

સવારે 11 થી 11:45 વાગ્યા સુધી: વોર્ડ્સ 1 અને 5

340 વોડેન સ્ટ્રીટ ઈસ્ટ સ્થિત સેન્ટ્યુરી ગાર્ડન્સ રિક્લિએશન સેન્ટરની મુલાકાત લેશો જ્યાં તમને મેયર બ્રાઉન કાઉન્સિલર્સ રોવેના સેન્ટોસ (Rowena Santos) અને પૉલ વિસેંટે (Paul Vicente) સાથે જોવા મળશે! ધી જાઝ મૅકેનિક્સ તરફથી જીવંત સંગીતનો આનંદ માણો, ધી માર્શટી કોબમાંથી ખાદ્યપદાર્થો ખરીદો, અને સ્થાનિક બેકરી ઓક્કેશન્સ (OccaSSions) તરફથી મફત કૂકીનો આનંદ લેશો.

બપોરે 12 થી 12:45 વાગ્યા સુધી: વોર્ડ્સ 2 અને 6

1050 સેન્ટલવૂડ પાર્કવે વેસ્ટ સ્થિત કેસી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટરમાં એબ્લેટ એન્ડ કૂપર તરફથી જીવંત સંગીતનો આનંદ માણો, ધી માર્શટી કોબમાંથી ખાદ્યપદાર્થો ખરીદો, અને સ્થાનિક ગ્રાન્ડ બેકર્સ તરફથી મફત કૂકીનો આનંદ લેશો. મેયર બ્રાઉન અને કાઉન્સિલર્સ માઈકલ પાલેશી (Michael Palleschi) અને ડગ વિલલન્સ (Doug Whillans) કૂકીસનું વિતરણ સીધું તમારા વાહનમાં કરશે.

બપોરે 1 થી 1:45 વાગ્યા સુધી: વોર્ડ્સ 3 અને 4

69 ઓલિવટ સ્ટ્રીટ સ્થિત મેમોરિયલ અરેનામાં બ્રેમ્પટન ફોક ક્લબ તરફથી જીવંત સંગીતનો આનંદ માણો, જેમી'સ કેકડ કોર્ન પાસેથી ખાદ્યપદાર્થો ખરીદો, અને સ્થાનિક ક્લિસ્ટિના'સ ટોર્ટિના શોપમાંથી મફત કૂકીનો આનંદ લેશો, મેયર બ્રાઉન અને કાઉન્સિલર્સ જેફ બોમેન (Jeff Bowman) અને માર્ટિન મેડેઈરોસ (Martin Medeiros) કૂકીસનું વિતરણ સીધું તમારા વાહનમાં કરશે.

બપોરે 2 થી 2:45 વાગ્યા સુધી: વોર્ડ્સ 7 અને 8

1100 સેન્ટ્રલ પાર્ક સ્થિત ગ્રીનબ્રાયર રિક્લિએશન સેન્ટરની મુલાકાત સેલ્વિક બેન્ડ ઓરિન'સ માર્લોર તરફથી જીવંત સંગીતનો આનંદ માણો, ધી માર્શટી કોબ પાસેથી ખાદ્યપદાર્થો ખરીદો, અને કેક્સ બાય એમિલી કે. તરફથી મફત કૂકીનો આનંદ લેશો. મેયર બ્રાઉન અને કાઉન્સિલર્સ પેટ ફોર્ટિની (Pat Fortini) અને ચાર્માઈન વિલિયમ્સ (Charmaine Williams) હાજર રહેશે.

બપોરે 3 થી 3:45 વાગ્યા સુધી: વોર્ડ્સ 9 અને 10

10150 ધી ગૌર રોડ સ્થિત ગૌર મીડોસ કમ્યુનિટી સેન્ટરમાં બગ્ગા સિંહ તરફથી જીવંત સંગીતનો આનંદ માણો, ધી માર્ટી કોબમાંથી ખાદ્યપદાર્થો ખરીદો, અને સ્થાનિક બેકરીસ લાકોસ્ટે બેકરી અને કૂકીસ બાય ડિઝાઇન તરફથી મફત કૂકીનો આનંદ લેશો. અહીં, કાઉન્સિલર્સ ગુરપ્રીત ધિલ્લોન (Gurpreet Dhillon) અને હરકિરત સિંહ (Harkirat Singh) મેયર બ્રાઉન સાથે જોડાશે.

COVID-19 સુરક્ષા ઉપાયો

COVID-19 નો ફેલાવો ટાળવાના હેતુસર, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના ઉપાયો અમલમાં રહેશે, અને રહેવાસીઓને ડ્રાઇવ-થ્રૂ કેનેડા ડે અનુભવવા પોતાના વાહનોમાં રહેવાનું કહેવામાં આવે છે. આપણું શહેર હાજર રહેનારાઓને માસ્ક પહેરવાનું અને અંગત ડિસ્ટન્સકેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાની વિનંતી કરે છે.

ઉજવો કેનેડા ડે – ઓનલાઈન!

બ્રેમ્પટનવાસીઓને પોતાના ઘરોમાંથી કેનેડા ઉજવવામાં મદદરૂપ થવા, આ શહેર ઓનલાઈન ઉજવણી વેબસાઈટ www.brampton.ca/canadaday પર કરી રહ્યું છે. જુલાઈ 1 નાં રોજ બપોરથી રાત્રે 10 વાગ્યા સુધી, રહેવાસીઓ કુટુંબ-અનુકૂળ પ્રવૃત્તિઓ, વર્ચ્યુઅલ (વાસ્તવિક) આતશબાજી, કુટુંબીજનોના મનપસંદ અને JUNO એવોર્ડ-વિજેતા સ્પેલેશ'એન બૂટ્સ, સ્થાનિક કલાકારો અને JUNO એવોર્ડ-વિજેતા હેડલાઈન બનાવનાર વોક ઓફ ધી અર્થનું પ્રેઝન્ટેશન્સ, અને ઘણું બધુંનો આનંદ માણી શકે છે.

વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/canadaday.

અવતરણો (ક્વોટ્સ):

“કેનેડા ડે બ્રેમ્પટનનો સૌથી મોટો ઉત્સવ છે અને અમે આ વર્ષે ચિંગકુસી પાર્કમાં રૂબરૂમાં ઉજવણીનું આયોજન કરી શકતા નથી ત્યારે, અમે COVID-19 સુરક્ષા ઉપાયોને મોખરે ધ્યાનમાં રાખીને કેનેડા ડે રૂબરૂમાં ઉજવવાની નવી રીત બનાવી છે. જુલાઈ 1 નાં રોજ હેલો કહેવા પધારો, પછી ઓનલાઈન ઉજવણી કરવા ઘરે પરત ફરશો!”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે કેનેડા ડે સાથે મળીને સુરક્ષિત અને આરોગ્યપ્રદ રીતે ઉજવવા રહેવાસીઓને મળવા બહુ રોમાંચ અનુભવીએ છીએ. હું દરેક વ્યક્તિને માસ્ક પહેરવા, સરસ સ્વચ્છતાશાસ્ત્ર અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવા, અને અમારી સાથે ફૂડ, સંગીત અને મોજ કરવા રૂબરૂમાં જોડાઈ જવા પ્રોત્સાહિત કરું છું. પછી, પ્રેઝન્ટેશન્સ અને આતશબાજીનો ઓનલાઈન આનંદ વેબસાઈટ પર લેશો, www.brampton.ca/canadaday.”

- ગુરપ્રીત ધિલ્લોન (Gurpreet Dhillon), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન; અધ્યક્ષ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિ

“અમે શહેરને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા કાર્યરત છીએ અને આપણો સમુદાય કેનેડાના જન્મદિવસની ઉજવણી કરવા સાથે જોડાઈ રહ્યો છે ત્યારે, હું દરેક વ્યક્તિને ઉત્સવમાં ભાગ લેવા અને પોતે અન્ય લોકોથી અંતર જાળવીને શક્ય એટલી સુરક્ષિત રીતે ઉજવણી કરવા અને સમગ્ર બ્રેમ્પટનમાં જીવંત મનોરંજનનો આનંદ માણવા પ્રોત્સાહિત કરું છું.”

- માર્ટિન મેડેયોસ (Martin Medeiros), રીજયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; લીડ (આગેવાન), રિઓપનીંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સીટી ઓફ બ્રેમ્પટન

“મેયર અને તમારા કાઉન્સિલર્સને મળવાથી માંડીને, જીવંત મનોરંજન, ઓનલાઇન પ્રેઝન્ટેશન્સ, કુટુંબ-અનુકૂળ પ્રવૃત્તિઓ અને આતશબાજી સુધી, દરેક વ્યક્તિ માટે આ કેનેડા ડે ઉજવવા આરોગ્યપ્રદ અને સુરક્ષિત રીતો સુલભ છે. કૃપા કરી સુરક્ષિત રહો, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવો, અને રાત્રે સમાપન તમારા ઘરેથી ઓનલાઇન કરશો.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca